

બુકિંગ એગ્રીમેન્ટ (બાનાખતનો કરાર)

રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ - ૫ (નારોલ) મણીનગર તાલુકાના મોજે - ઇસનપુર ગામની સીમના સર્વે નંબર : ૫૩૯ ની ચો.મીટર : ૫૩૬૨ ની જમીન કે જેનો ટી.પી. સ્કીમ નંબર : ૫૪ (ઇસનપુર) માં સમાવેશ કરીને ફાઇનલ પ્લોટ નંબર : ૬૭+૬૮ ની ચો.મીટર : ૪૦૩૦ ની જમીન ફાળવી આપવામાં આવેલ છે. તેવી બિનખેતીની જમીન ઉપર “**થેર્થ પેરેડાઇઝ**” ના નામથી ફ્લેટો તથા દુકાનોનું બાંધકામ કરવામાં આવનાર છે, તેમાં આવેલ મીલકત અંગે બાનાખતનો કરાર.

અમો / વેચાણ આપનાર - લખી આપનાર - એકતરફવાળા :-

⇒ ધૈર્ય ડેવલોપર્સ

PAN : AAKFD 5118 L

એ નામની ભાગીદારી પેઢી જેની રજીસ્ટર્ડ ઓફિસ :- પટેલવાડી નંબર : ૨ ની પાસે, મોની હોટલના ખાંચામાં, ચિરાગ રો - હાઉસની સામે, ઇસનપુર, અમદાવાદ-૩૮૨૪૪૩ ના સરનામે આવેલી છે. તેના વતી અને તરફથી તેના વહિવટકર્તા ભાગીદાર :- પવન ભરતભાઈ પટેલ

(મોબાઈલ નંબર :)

(મેઈલ આઈ.ડી. નંબર :)

જેમને હવે પછી આ બાનાખતના કરારમાં “અમો” અને અગર અમો “વેચાણ આપનાર - લખી આપનાર - એકતરફવાળા” એ રીતે સંબોધવામાં આવ્યા છે જે શબ્દના અર્થમાં અમો વેચાણ આપનાર ભાગીદારી પેઢીનો તથા ભાગીદારી પેઢીના હાલના તથા વખતો વખતના ભાગીદારો તથા ભાગીદારોના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એકઝીક્યુટરો તમામનો સમાવેશ થાય છે.

એલોટી / સભ્ય / વેચાણ લેનાર - બીજતરફવાળા :-

⇒

PAN :

પુખ્તવયના, ધર્મે : હિન્દુ, રહેવાસી :

.....

(મોબાઈલ નંબર :)

(મેઈલ આઈ.ડી. નંબર :)

જેમને હવે પછી આ બાનાખતના કરારમાં “તમો” અને અગર તમો “વેચાણ લેનાર - લખાવી લેનાર - બીજતરફવાળા” એ રીતે સંબોધવામાં આવ્યા છે. જે શબ્દના અર્થમાં તમો વેચાણ લેનારનો તથા તમો વેચાણ લેનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એકઝીક્યુટરો, એડમીનીસ્ટ્રેટરો, સકશેસરો, સરવાઈવરો ઈત્યાદી સર્વેનો સમાવેશ થાય છે.

આ બુકિંગ એગ્રીમેન્ટ અંગેનો લેખ અમો એકતરફવાળા પ્રયોજક અને તમો બીજતરફવાળા સભ્ય વચ્ચે નીચેની વિગતો એન શરતો મુજબ કરવામાં આવે છે.

- (૧) જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ - ૫ (નારોલ) મણીનગર તાલુકાના મોજે-ઈસનપુર ગામની સીમના સર્વે નંબર : ૫૩૯ ની ચો.મીટર : ૫૩૬૨ ની જમીન કે જેનો ટી.પી. સ્કીમ નંબર : ૫૪ (ઈસનપુર) માં સમાવેશ કરીને ફાઈનલ પ્લોટ નંબર : ૬૭ + ૬૮ ની ચો.મીટર : ૪૦૩૦ ની જમીન ફાળવી આપવામાં આવેલ છે. તેવી બિનખેતીની જમીન ઉપર “ **થેર્થ પેરેડાઈઝ** ” ના નામથી ફ્લેટો તથા દુકાનોનું બાંધકામ કરવામાં આવનાર છે, તેમાં આવેલ બ્લોક નંબર : ના ફ્લોરનો ફ્લેટ નંબર : વાળી ચો.મીટર : ના કાર્પેટ ક્ષેત્રફળવાળી (રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ - ૨૦૧૬ ના નિયમોનુસાર) મીલકત તથા સદર ફાઈનલ પ્લોટની ચો.મીટર : ૪૦૩૦ ની જમીન પૈકી બાંધકામના પ્રમાણમાં વણ વહેચાયેલ ચો.મીટર : ના હક્ક સહિતની મીલકત આ બાનાખતના કરારથી વેચાણ આપવાનું નક્કી કરેલ છે. જેનું સંપૂર્ણ વર્ણન નીચે પરીશીષ્ટમાં આપવામાં આવેલ છે. જેને હવે પછી આ બાનાખતના કરારમાં “સદરહુ મીલકત” એ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- (૨) મજકુર સર્વે નંબર : ૫૩૯ ની ચો.મીટર : ૫૩૬૨ ની જમીન કે જેનો ટી.પી. સ્કીમ નંબર : ૫૪ (ઈસનપુર) માં સમાવેશ કરીને ફાઈનલ પ્લોટ નંબર : ૬૭+૬૮ ની ચો.મીટર : ૪૦૩૦ ની જમીન ફાળવી આપવામાં આવેલ છે તેવી જમીનને બિનખેતીમાં તબદીલ કરાવવા સારૂ અરજી કરતાં મે.ક્લેક્ટર સાહેબશ્રી, અમદાવાદના તારીખ : ૦૩-૦૫-૨૦૧૬ ના રોજ હુકમ નંબર : સીબી / લેન્ડ-૧ / એન.એ. / એસ.આર. ૨૧૪૧ / ૨૦૧૫ થી ચો.મીટર : ૩૭૩૦ ની જમીન રહેણાંક તથા ચો.મીટર : ૩૦૦ ની જમીન વાણિજ્યના હેતુ માટેની બિનખેતીની પરવાનગી આપેલ. જે હુકમ અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં ફેરફાર એન્ટ્રી નંબર : ૭૮૮૮, તારીખ : ૧૦-૦૫-૨૦૧૬ ના રોજ કરવામાં આવેલ. જે નોંધ ઓથોરાઈઝ અધિકારી મારફતે તારીખ : ૦૪-૦૭-૨૦૧૬ ના રોજ પ્રમાણીત કરવામાં આવેલ.
- (૩) મજકુર સમગ્ર જમીન ભરતભાઈ મોતીભાઈ તથા અશોકભાઈ મોતીભાઈની માલિકી, કબજા, ભોગવટાની આવેલી અને તેઓની પાસેથી સદરહુ જમીન અમો વેચાણ આપનાર ભાગીદારી પેઢીએ વેચાણ રાખેલ. જે બાબતનો વેચાણ દસ્તાવેજ અમદાવાદ - ૫ (નારોલ) ના મે. સબ-રજીસ્ટ્રાર સાહેબની કચેરીમાં તારીખ : ૧૪-૧૨-૨૦૧૬ ના રોજ અનુક્રમ નંબર : ૮૩૬૮ થી રજુ કરવામાં આવેલ. જે દસ્તાવેજ તારીખ : ૨૧-૧૨-૨૦૧૬ ના રોજ નોંધવામાં આવેલ. જે

-: ૪ :-

વેચાણ અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં ફેરફાર એન્ટ્રી નંબર :,
તારીખ : ના રોજ કરવામાં આવેલ.

- (૪) સદર ફાઈનલ પ્લોટ નંબર : ૬૭ + ૬૮ ની ચો.મીટર : ૪૦૩૦ ની જમીન ઉપર ફ્લેટો તથા દુકાનોનું બાંધકામ કરવા માટેના પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તારીખ : ૧૫-૧૦-૨૦૧૬ ના રોજના નીચે મુજબના કેસ નંબરથી મંજૂર કરવામાં આવેલ.

બ્લોક નંબર

કેસ નંબર

A

BLNTI / SZ / 020816 / GDR / A6925 / R0 / M1

(રજાચીટ્ટી નંબર : 7136 / 020816 / A6925 / R0 / M1)

B + C

BLNTI / SZ / 020816 / GDR / A6926 / R0 / M1

(રજાચીટ્ટી નંબર : 7137 / 020816 / A6926 / R0 / M1)

D

BLNTS / SZ / 020816 / GDR / A6927 / R0 / M1

(રજાચીટ્ટી નંબર : 7138 / 020816 / A6927 / R0 / M1)

E + F

BLNTI / SZ / 020816 / GDR / A6928 / R0 / M1

(રજાચીટ્ટી નંબર : 7139 / 020816 / A6928 / R0 / M1)

એ રીતેની ઉપર મુજબના કેસ નંબરથી સદરહુ જમીન ઉપર બાંધકામ કરવા અંગેના પ્લાન મંજૂર કરવામાં આવેલ. જે મંજૂર થયેલા પ્લાન મુજબ રહેઠાણના ફ્લેટો તથા વાણિજ્યના હેતુ માટેની દુકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે, જેનું નામ “ધૈર્ય પેરેડાઈઝ ” રાખવામાં આવેલ છે. સદરહુ સમગ્ર જમીન બિનખેતીની અને બાંધકામ યોગ્ય બનેલ તેમજ સદર સ્કીમમાં મંજૂર થયેલ પ્લાન અને લાગુ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ નિયમાનુસાર / નાગરીક આધાર રૂપ જરૂરીયાત મુજબ પાણી, ગટર અને વિજળી સહિતની લખી આપનારે નક્કી કરેલ અને જણાવ્યા મુજબ જરૂરી સુવિધાઓયુક્ત બાંધકામ કરવા / કરાવવાની યોજના અમલમાં મુકેલ છે.

- (૫) સદરહુ મીલકત ઉપર કોઈ સંસ્થા, બેંક, પેઢી, શ્રોફ, વ્યક્તિઓ, સરકારશ્રીનો કે ગ્રામ પંચાયત કે સ્થાનિકલ સંસ્થાઓનો વિગેરે કોઈનો બોજો કે કોઈ લોન નથી કે કોઈના જામીનમાં નથી. તેમજ કોઈ કોર્ટ કચેરી કે ઓફિસોમાં કોઈપણ

જાતના કેસો કે પ્રોસેડિંગ્સ ચાલતા નથી કે કોઈ હુકમનામું થયેલ નથી. સદર મીલકતમાં કોઈપણ જાતના રીઝર્વેશન કે કપાતમાં નથી કે ગ્રીન બેલ્ટમાં નથી. તેમજ તેના ઉપર કોઈનો ભરણ પોષણનો કે અન્ય કોઈ હક્ક પોષાતો નથી તેમજ કોઈને કોઈપણ પ્રકારના લખાણોથી લખી આપેલ નથી. કોઈને કબજો સોપેલ નથી. તેવી તમામ પ્રકારના રાઈટ ટાઈટલ્સ ચોખ્ખા અને મોર્કેટેબલ હોવા અંગેની તમામ ખાતરીઓ અમો આપીએ છીએ. જે અંગેનું ટાઈટલ સર્ટીફિકેટ એડવોકેટશ્રી એ તારીખ : ના રોજ આપવામાં આવ્યું છે.

- (૬) સદરહુ સમગ્ર જમીન ઉપર જે રહેણાંકના ફ્લેટો તથા વાણિજ્યની દુકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે. તે બાંધકામવાળી મીલકત “ ધૈર્ય પેરેડાઈઝ ” એ નામથી ઓળખાશે અને સદરહુ નામમાં ફેરફાર કરવાનો તમો લખાવી લેનાર - બીજીતરફવાળાને કોઈ હક્ક કે અધિકાર નથી.
- (૭) સદરહુ જમીનમાં મંજૂર થયેલા પ્લાન તથા રજાચીટ્ટી મુજબ એપાર્ટમેન્ટ ટાઈપના રહેણાંકના ફ્લેટો તથા વાણિજ્યની દુકાનોના બાંધકામની યોજના નિયમ બધ્ધ અમો વેચાણ આપનાર - એકતરફવાળા ધૈર્ય ડેવલોપર્સ એ નામની ભાગીદારી પેઢી દ્વારા મુકવામાં આવેલ છે અને સદર જમીન અમો લખી આપનાર - એકતરફવાળાની માલિકી, કબજા, ભોગવટાની બોજા રહિત મીલકત આવેલ છે.
- (૮) સદરહુ સમગ્ર જમીન ઉપર મુકવામાં આવેલ “ ધૈર્ય પેરેડાઈઝ ” નામની યોજનામાં પેરા નંબર : ૧ માં દર્શાવ્યા મુજબની મીલકત તેને આનુસંગિક નીચે મુજબના હક્કો તથા હિતો સહિતની મીલકત ઉચ્ચક અઘાટ વેચાણ કિંમત રૂા..... અંકે રૂપીયા પુરા માટે વેચાણ આપવાનું નક્કી કરેલ છે. જે કિંમતમાં નીચે દર્શાવ્યા મુજબના હક્કો તથા હિતોની કિંમતનો પણ સમાવેશ થઈ જાય છે.

એ :- સદરહુ મીલકતની આનુસંગિક બાલકની નંગ - ૧ ની ચો.મીટર : ના કાર્પેટ ક્ષેત્રફળવાળી મીલકતની કિંમતનો કુલ નક્કી કરેલ અવેજની રકમમાં સમાવેશ થઈ ગયેલ છે.

બી :- સદરહુ મીલકતને આનુસંગિક વરંડો નંગ - ૧ ની ચો.મીટર :

-: ૬ :-

..... ના કાર્પેટ ક્ષેત્રફળવાળી મીલકતની કિંમતનો કુલ નક્કી કરેલ અવેજની રકમમાં સમાવેશ થઈ ગયેલ છે.

સી :- સદરહુ મીલકતને આનુસંગિક વોશ એરીયા નંગ - ૧ ની ચો.મીટર : ના કાર્પેટ ક્ષેત્રફળવાળી મીલકતની કિંમતનો કુલ નક્કી કરેલ અવેજની રકમમાં સમાવેશ થઈ ગયેલ છે.

એ રીતે ઉપર મુજબના પેરા નંબર : ૮ / એ થી ૮ / સી માં દર્શાવ્યા મુજબના ક્ષેત્રફળનો કુલ કાર્પેટ એરીયા ચો.મીટર : માં સમાવેશ થયેલ છે.

(૯) સદરહુ મીલકત અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકએ તમો એલોટી સભ્યને ઉપર દર્શાવ્યા મુજબ અઘાટ વેચાણ કરવાનું નક્કી કરેલ છે. તે પૈકી નીચે મુજબની વિગતે તમો વેચાણ લેનારે બાનાપેટેની રકમ ચુકવી આપેલ છે.

રૂા.

રૂા.

રૂા..... અંકે રૂપીયા પુરા.

એ રીતે ઉપર મુજબની વિગતે અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકોને તમો લખાવી લેનાર - બીજીતરફવાળા એલોટી સભ્યએ આજ અગાઉ ચુકવેલ છે તે પૈકી બાકી રહેતી અવેજની રકમ નીચે મુજબના હપ્તા, તારીખ અને ટકાવારી પ્રમાણે ચુકવવાનું તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્યએ માન્ય અને કબુલ રાખેલ છે.

હપ્તો

રકમ

તારીખ

ટકાવારી

પહેલો
બીજો
ત્રીજો

- (૧૦) સદર મીલકતની ઉપરોક્ત નક્કી કરેલ હપ્તા અને તારીખ પ્રમાણે અવેજની રકમ ચુકવવામાં વિલંબ થાય તો તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્યને અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજક રજીસ્ટર્ડ પોસ્ટ થી કે ઈ - મેઈલથી બાકી રકમ ચુકવવાની નોટીસ આપીશુ અને તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્ય આપેલ નોટીસનો યોગ્ય જવાબ કે બાકી રહેતી રકમ ૧૫ દિવસની મુદતની અંદર ચુકવવામાં કસુર કે વિલંબ કરશો તો તમો એલોટી સભ્યએ ત્યારબાદ બાકી રહેતી અવેજની રકમ ઉપર ૧ (એક) ટકા લેખે માસિક વ્યાજ ચુકવવાનું રહેશે. તે શરત તમો લખાવી લેનાર - બીજીતરફવાળા એલોટી સભ્યએ કબુલ અને માન્ય રાખેલ છે.
- (૧૧) સદર ફ્લેટ / દુકાન / મીલકતનું વપરાશ અંગેનું સર્ટીફિકેટ લાગુ ઓથોરીટી પાસેથી આશરે ની સાલમાં આવશે અને સદર મીલકતનું વપરાશ અંગેનું સર્ટીફિકેટ આવે તેની જાણ અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકોએ તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્યને ૭ દિવસમાં કરવાની રહેશે. પરંતુ જો કુદરતી આફત, આગ, ધરતી કંપ કે અન્ય કોઈ કુદરતી કે માનવસર્જિત સંજોગોમાં કે સરકાર દ્વારા કાયદાકીય કલમોમાં ફેરફાર થવાથી પઝેશન આપવામાં વિલંબ થાય તો તમો લખાવી લેનાર - બીજીતરફવાળા એલોટી સભ્યએ માન્ય અને કબુલ રાખવાનું રહેશે અને તે અંગે કોઈપણ પ્રકારની તકરાર કરવા / કરાવવાની નથી.
- (૧૨) સદર ફ્લેટ / દુકાન / મીલકતનું પઝેશન અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકે તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્યને આશરે ની સાલમાં આપવામાં આવશે. પરંતુ સદર મીલકતનું વપરાશ અંગેનું સર્ટીફિકેટ આવવામાં વિલંબ થાય તો પઝેશન આપવાની મુદતમાં આપોઆપ વધારો થશે જે તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્યએ કબુલ અને માન્ય રાખવાનો છે અને રહેશે.
- (૧૩) સદર મીલકત નક્કી કરેલ મુદતમાં પઝેશન આપવામાં ઉપરોક્ત જણાવેલ કારણ સિવાય અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકોને લીધે પઝેશન આપવામાં

વિલંબ થાય તો તમો લખાવી લેનાર - બીજીતરફવાળાએ ચુકવેલ અવેજની રકમ ઉપર ૧ (એક) ટકા લેખે માસિક વ્યાજ અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકએ ચુકવવાનું રહેશે.

- (૧૪) અમો લખી આપનાર - એકતરફવાળા સદર મીલકત તમો લખાવી લેનારને આજ રોજથી વેચાણ આપીએ છીએ અને આથી અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકએ સદર મીલકત ગીરોમાં કે જામીનમાં મુકવાની નથી કે તેના ઉપર કોઈપણ લોન લેવાની નથી કે મીલકતની વેલ્યુ ઘટે તેવા કાર્યો કરવા / કરાવવાના નથી તે અંગેની બાંહેધરી અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજક તમો લખાવી લેનારને આપીએ છીએ.
- (૧૫) અમો એકતરફવાળા પ્રયોજકો અને તમો બીજીતરફવાળા સભ્ય બંને સાથે મળીને એકબીજાની પરસ્પર સમજુતીથી આ બુકિંગ એગ્રીમેન્ટની શરતમાં ફેરફાર કરી શકશે.
- (૧૬) અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકોએ “ ધૈર્ય પેરેડાઈઝ ” નામની સ્કીમની જમીન ઉપર અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના મંજુર થયેલ પ્લાન મુજબ બાંધકામ કરવાનું છે અને તે મંજુર થયેલ પ્લાનમાં ફેરફાર કરવાનો થાય તો અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજક અને તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્ય સાથે મળીને એકબીજાની પરસ્પર સમજુતીથી બાંધકામમાં સુધારો વધારો કરી શકશે. પરંતુ અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકો દ્વારા આયોજીત સદર સ્કીમના સ્પેશીફીકેશન અને પ્લાન કે બિલ્ડીંગના બાંધકામ બાબતે કોઈપણ પ્રકારના સુધારા વધારાઓ નિયમોનુસાર કરવા કરાવવાની જરૂરીયાત ઉદભવે તેમાં તમો લખાવી લેનાર - બીજીતરફવાળા એલોટી સભ્યની મુક્ત અને કાયમી સંમતી છે અને રહેશે.
- (૧૭) સદરહુ ફાળવેલ / વેચાણ આપેલ મીલકતને લઈને અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજક અને તમો લખાવી લેનાર - બીજીતરફવાળા એલોટી સભ્ય વચ્ચે કોઈપણ પ્રકારનો વિવાદ કે તકરાર ઉપસ્થિત થાય તો બંને એકબીજા સાથે મળીને પરસ્પર સમજુતીથી ઉપસ્થિત થયેલ વિવાદ કે તકરારનો ઉકેલ લાવવાનો રહેશે. તેમ છતાં તે વિવાદ કે તકરારનો ઉકેલ ન આવે તો રેરા એક્ટ - ૨૦૧૬ ની ઓથોરીટીના નિતી નિયમો મુજબ ઉકેલ લાવવાનો રહેશે.

(૧૮) સદર ફાળવેલ / વેચાણ આપેલ મીલકતની બાંધકામમાં સ્ટ્રક્ચર ખામી અથવા વર્કમેનશીપની અથવા માલ - સામાનની ગુણવત્તા અથવા સેવાની જોગવાઈ બાબતે કે ડેવલપમેન્ટ સંબંધે કે બુકિંગ એગ્રીમેન્ટની સમજૂતી મુજબ અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકના અન્ય બંધનો - ફરજો અંગેની ખામી તમો લખાવી લેનાર - બીજીતરફવાળા એલોટી સભ્ય દ્વારા કબજો સોંપ્યાની તારીખથી વર્ષ - ૫ ના સમયગાળાની અંદર અમો એકતરફવાળા પ્રયોજકોની જાણકારીમાં લાવવામાં આવે તો અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકોની ફરજ બનશે કે ૩૦ દિવસની અંદર વધારાનો ચાર્જ વસુલ કર્યા સિવાય એવી ખામીઓ સુધારી આપવાની રહેશે. પરંતુ સદરહુ મીલકતમાં વેચાણ લેનાર પોતે કે પોતાના પ્રતિનિધી મારફતે સ્ટ્રક્ચર કે તેના મુળભુત ફીટીંગ્સમાં કોઈપણ ફેરફાર કે તોડફોડ કરાવે અને તેથી કરીને બિલ્ડીંગ કે ફીટીંગ્સમાં ખામી સર્જાય તો તે અંગે વેચાણ આપનાર - એકતરફવાળાને જવાબદાર ગણી શકાશે નહિ અને તેવા સંજોગોમાં તેવી કોઈ ગેરંટી કે બાંહેધરી અમલી ગણાશે નહિ.

-: પરિશિષ્ટ :-

રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ - ૫ (નારોલ) મણીનગર તાલુકાના મોજે-ઈસનપુર ગામની સીમના સર્વે નંબર : ૫૩૯ ની ચો.મીટર : ૫૩૬૨ ની જમીન કે જેનો ટી.પી. સ્કીમ નંબર : ૫૪ (ઈસનપુર) માં સમાવેશ કરીને ફાઈનલ પ્લોટ નંબર : ૬૭ + ૬૮ ની ચો.મીટર : ૪૦૩૦ ની જમીન ફાળવી આપવામાં આવેલ છે. તેવી બિનખેતીની જમીન ઉપર “ **થેર્થ પેરેડાઈઝ** ” ના નામથી ફ્લેટો તથા દુકાનોનું બાંધકામ કરવામાં આવનાર છે, તેમાં આવેલ બ્લોક નંબર : ના ફ્લોરનો ફ્લેટ નંબર : વાળી ચો.મીટર : ના કાર્પેટ ક્ષેત્રફળવાળી (રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ - ૨૦૧૬ ના નિયમોનુસાર) મીલકત તથા સદર ફાઈનલ પ્લોટની ચો.મીટર : ૪૦૩૦ ની જમીન પૈકી બાંધકામના પ્રમાણમાં વણ વહેચાયેલ ચો.મીટર : ના હક્ક સહિતની મીલકત.

“ થેર્થ પેરેડાઈઝ ” ના ખુંટચારની વિગત :-

પૂર્વ :- કોર્પોરેશન રીઝર્વેશન પ્લોટ
પશ્ચિમે :- નંદનવનપાર્ક
ઉત્તરે :- ટી.પી.રોડ
દક્ષીણે :- વારાહી પાર્ક

વેચાણ આપવાનું નક્કી કરેલ મીલકતના ખુંટચારની વિગત :-

પૂર્વ :-

પશ્ચિમે :-

ઉત્તરે :-

દક્ષિણે :-

એ રીતેનો ઉપર મુજબનો આ બાનાખતનો કરાર અમો વેચાણ આપનારે તથા તમો વેચાણ લેનારે રાજીખુશીથી તથા અક્કલ હોંશીયારીથી વાંચી, સમજી, વિચારીને કોઈના કોઈપણ જાતના દાબ દબાણ વગર, બિનિકેફે, તંદુરસ્ત સ્થિતિમાં કરેલ છે, જે અમો વેચાણ આપનારને તથા અમો વેચાણ આપનાર ભાગીદારી પેઢીના હાલના તથા વખતો વખતના ભાગીદારો તેમજ ભાગીદારોના વંશ,વાલી, વારસો, સક્સેશરો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમીનીસ્ટ્રેટરો તેમજ તમો લખાવી લેનારને તથા તમો લખાવી લેનારના વંશ,વાલી, વારસો, સક્સેશરો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમીનીસ્ટ્રેટરો ઈત્યાદી તમામને કબુલ, મંજૂર અને બંધનકર્તા છે અને રહેશે, અમદાવાદ મધ્યે આજ તારીખ : -૦૭-૨૦૧૭ ના દિને.

(અમો / વેચાણ આપનાર – લખી આપનાર – એકતરફવાલા)

⇒ ધૈર્ય ડેવલોપર્સ

ના વતી અને તરફથી તેના

વહિવટકર્તા ભાગીદાર :-

પવન ભરતભાઈ પટેલ


(સાક્ષીઓ)

૧ _____

૨ _____


-: ૧૧ :-

રજીસ્ટ્રેશન અધિનીયમની કલમ-૩૨(અ) મુજબનું પરીશીષ્ટ નીચે મુજબ છે.
(અમો / વેચાણ આપનાર – લખી આપનાર – એકતરફવાળા)



⇒ ધૈર્ય ડેવલોપર્સ - એ નામની ભાગીદારીના વતી અને તરફથી તેના વહિવટકર્તા
ભાગીદાર :- પવન ભરતભાઈ પટેલ

(તમો / વેચાણ લેનાર – લખાવી લેનાર – બીજીતરફવાળા)



આજ તા. માહે સને-૨૦૧૭
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ
અમદાવાદ - ૫ (નારોલ) મણીનગર તાલુકાના મોજે-
ઈસનપુર ગામની સીમના સર્વે નંબર : ૫૩૯ ની
ચો.મીટર : ૫૩૬૨ ની જમીન કે જેનો ટી.પી. સ્કીમ
નંબર : ૫૪ (ઈસનપુર) માં સમાવેશ કરીને ફાઈનલ
પ્લોટ નંબર : ૬૭ + ૬૮ ની ચો.મીટર : ૪૦૩૦ ની
જમીન ફાળવી આપવામાં આવેલ છે. તેવી
બિનખેતીની જમીન ઉપર “ **ધેર્ય પેરેડાઈઝ** ” ના
નામથી ફ્લેટો તથા દુકાનોનું બાંધકામ કરવામાં
આવનાર છે, તેમાં આવેલ મીલકત.

બાનાખતનો કરાર

BALCHANDBHAI K. PATEL ASSOCIATES
MANISH K. PATEL (ADVOCATE)
CHIRAG D.PATEL (ADVOCATE)
AMIT D.PATEL (ADVOCATE)
7/A, First Floor, Jay Jalaram Society,
Opp. Jain Temple, Nr. Vyas Vadi Char
Rasta, Nava Vadaj, Ahmedabad.
Phone (O) 27645894
(M) 98259 40880.
(M) 97273 44333
(M) 97272 44333